

માટે ઓનલાઈન શાળા પસંદગી અંગેની સૂચનાઓ

- શિક્ષણ વિભાગના તા.૧૫/૧૧/૧૯ના જાહેરનામાની બેગવાઈઓ મુજબ વેબસાઈટ પર તા.૧૫/૦૯/૨૦૨૧ના રોજ **Qualified** વેઈટિંગ લીસ્ટ-૩ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
- સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અન્વયે વિષયવાર, કેટેગરીવાર ઉપલબ્ધ ખાલી જગ્યાઓ અને ઉપલબ્ધ ઉમેદવારોના આધારે **Qualified** વેઈટિંગ લિસ્ટ-૩ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ **Qualified** વેઈટિંગ લિસ્ટ-૩માં સમાવિષ્ટ ઉમેદવારો દ્વારા અપાયેલ જિલ્લા પસંદગી તથા મેરીટના આધારે ઉમેદવારોને તેઓની પસંદગીનો જિલ્લો હાથવચેલ છે જેની વિગતો તા.૨૧/૦૯/૨૦૨૧ના રોજ વેબસાઈટ www.gserc.in પર મુકવામાં આવેલ છે. તેમજ સંબંધિત ઉમેદવારોને આ અંગેની **SMS** થી જાણ કરેલ છે.
- જિલ્લા હાથવણી થયેલ ઉમેદવારોએ તા.૨૧/૦૯/૨૦૨૧ના રોજ બપોરે ૨.૩૦ કલાકથી તા.૨૧/૦૯/૨૦૨૧ ના રોજ ૫.૦૦ કલાક સુધી વેબસાઈટ www.gserc.in પર પોતાની ઓનલાઈન શાળા પસંદગી આપી શકશે.
- જે ઉમેદવારોને જિલ્લા હાથવણી થયેલ છે તે ઉમેદવારોએ હરજિયાતપણે જે તે જિલ્લાની શાળાઓની ઓનલાઈન શાળા પસંદગી આપવાની રહેશે.
- ઓનલાઈન શાળા પસંદગી ન આપનાર ઉમેદવાર ભરતી પ્રક્રિયા અન્વયે પોતાનો હક્ક જતો કરવા ઇચ્છે છે તેમ માની તેઓને ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે. જેની સંબંધિતો ખાસ નોંધ લેવી.
- ઓનલાઈન શાળા પસંદગી આપવા માટે,

 - ઓનલાઈન શાળા પસંદગી માટે ઉમેદવારો જે રીતે ઓનલાઈન જિલ્લા પસંદગી માટે લોગઈન થયા હતા તે જ રીતે લોગઈન થવાનું રહેશે.
 - ઉમેદવાર વેબસાઈટ www.gserc.in પર જઈ **Apply for Secondary Government** વિકલ્પ ક્લિક કરવાનો રહેશે.
 - જે ક્લિક કરતા ખૂલેલ ચેકબોક્સમાં ઉમેદવારે પોતાનો ટાટ નંબર, જન્મતારીખ અને ફિક્સ **Captcha Code** નાખી લોગઈન થવાનું રહેશે.
 - લોગઈન થતાં ઉમેદવારના ઓનલાઈન અરજીફોર્મમાં રજિસ્ટર્ડ મોબાઈલ પર **OTP** આવશે. જે **OTP** એન્ટર કરતાં રહીને પર ઉમેદવારને મેરીટના આધારે હાથવેલ જિલ્લામાં ઉમેદવારના વિષયની જે શાળાઓમાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ હશે તેવી તમામ શાળાઓના નામ ઉમેદવારની રહીને પર ખેવા મળશે. દા.ત. ઉમેદવારનો વિષય અંગ્રેજી હોય અને ઉમેદવારને મેરીટના આધારે બનાસકાંઠા જિલ્લો હાથવચેલ હોય તો આ ઉમેદવારને બનાસકાંઠા જિલ્લામાં જે જે શાળામાં અંગ્રેજી વિષયની ખાલી જગ્યા હોય તેવી તમામ શાળાઓના નામ ઉમેદવારની રહીને પર દેખાશે. આ તમામ શાળાઓને ક્લિક કરી ઉમેદવારે પોતાના પસંદગીના ક્રમમાં ગોઠવવાના રહેશે.
 - ઓનલાઈન શાળા પસંદગી આપતી વખતે ઉમેદવારે તેઓ માટે ઉપલબ્ધ તમામ શાળાઓને પોતાની પસંદગીના ક્રમમાં ગોઠવવાના રહેશે, એટલે કે ૧૦૦% શાળા પસંદગી આપશો તો જ ઓનલાઈન શાળા પસંદગી સબમીટ થશે. અન્યથા આપની ઓનલાઈન શાળા પસંદગી રવીક્રત બનશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
 - ઉમેદવારો પોતાની શાળા પસંદગીમાં શાળા પસંદગી આપવાની છેલ્લી તા.૨૧/૦૯/૨૦૨૧ના રોજ સાંજે ૫.૦૦ કલાક સુધી ફેરફાર કરી શકશે. પરંતુ તા.૨૧/૦૯/૨૦૨૧ના રોજ સાંજે ૫.૦૦ કલાકે આપે જે શાળા પસંદગી આપેલ હશે તેને અંતિમ માની સોફ્ટવેર ઓટો સબમીટ આપી દેશે અને તદ્દનુસાર આપના મેરીટ મુજબ આપને સોફ્ટવેર ઓનલાઈન શાળા હાથવણી કરવામાં આવશે.
 - **શાળા હાથવણી બાદ જે તે શાળામાં નિમણૂક આપવા અંગે તથા નિમણૂકની શરતો અંગે આગામી અલગથી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવશે.**
 - ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ આપને શુભકામનાઓ પાઠવે છે.